

647510**BHS5DieC180x****Seat No : _____****B.Sc. (HS) Semester - 5 (Remedial) (CBCS) Examination****Feb/Mar. -2021 (NEW COURSE)****Dietetics -1(Core)****Time: 1:30 Hours****Marks: 30****Instructions:**

1. Figures to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

-
- | | | |
|----------|--|------|
| પ્રશ્ન.૧ | ફંક્શનલ ફૂડ્સ એટલે શું? ઘઉંના જવારા, સ્પાઇલીના, મશરૂમ તથા અળસી વિશે લખો. | (૧૦) |
| પ્રશ્ન.૨ | ડાયાબીટીસના પ્રકાર, લક્ષણો તથા કારણોની ચર્ચા કરો. | (૧૦) |
| પ્રશ્ન.૩ | એનીમીયાના લક્ષણો તથા ફોલીક એસીડથી થતો એનીમીયા ચર્ચો. | (૧૦) |
| પ્રશ્ન.૪ | સ્વસ્થ જીવન માટે આહાર સમજાવો. | (૧૦) |
| પ્રશ્ન.૫ | પેશન્ટ કાઉન્સેલીંગ સમજાવો. | (૧૦) |

ENGLISH VERSION

- | | | |
|-----|---|------|
| Q.1 | What are functional foods? Write about wheat grass. Spirulina, mushroom and flax seeds. | (10) |
| Q.2 | Diabetes – types, symptoms and its causes. | (10) |
| Q.3 | Discuss: symptoms of anaemia and Explain folic acid deficiency anaemia. | (10) |
| Q.4 | Explain diet for healthy living. | (10) |
| Q.5 | Discuss patient counseling. | (10) |
